

## સીટી ઓફ બ્રેમ્પટન AMO 2020 કોન્ફરન્સમાં: આર્થિક રિક્વરી અને વૃદ્ધિ માટે ભાગીદારી

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (ઓગસ્ટ 17, 2020) – ઓગસ્ટ 17 થી 19 સુધી, સીટી ઓફ બ્રેમ્પટનનું પ્રતિનિધિ મંડળ, એસોસિએશન ઓફ મ્યુનિસિપાલિટીસ (AMO) 2020 ની વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં સહભાગી થશે. મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown) ની આગેવાનીમાં, કાઉન્સિલના સભ્યો અને સીટી અધિકારીઓ બ્રેમ્પટનની સૌથી આવશ્યક જરૂરિયાતો પર પ્રોવિન્સના મુખ્ય હિતધારકો સાથે જોડાશે.

બેઠકો (મીટિંગ્સ) મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ, મિનિસ્ટ્રી ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મિનિસ્ટ્રી ઓફ એન્વાઇરોન્મેન્ટ, કન્ઝર્વેશન એન્ડ પાર્ક્સ, અને મિનિસ્ટ્રી ઓફ કોલેજીસ એન્ડ યુનિવર્સિટીસ સાથે મંજૂર થઈ છે.

COVID-19 સામે પ્રવર્તમાન પ્રતિક્રિયાને ધ્યાનમાં લેતા, આ વર્ષે સીટીની મહત્વની અગ્રતાઓમાંથી એક અગ્રતા પોતાની આર્થિક રીકવરી માટે સતત સહાયતા મેળવવાની છે. સીટી અધિકારીઓ શહેરની ટકાઉ વૃદ્ધિનું સંચાલન કરવાનો અને રહેવાસીઓના જીવનની ગુણવત્તા સુધારવાનો અતૂટ ભાગ હોય તેવી વધારાની અગ્રતાઓ પર પણ પ્રકાશ પાડશે, જેમાં સામેલ છે:

- **આરોગ્ય સંભાળ** – પીલ મેમોરિયલના ફેઝ ટૂ (તબક્કો બે) માટે અને ત્રીજી આરોગ્ય સંભાળ સગવડ માટે કટિબદ્ધતા.
- **ઉચ્ચતર ક્રમની ટ્રાન્ઝિટ** – ટ્રાન્ઝિટની નવી શૈલીઓમાં રોકાણમાં વધારો કરવો જેમાં સામેલ છે, દ્વિ-માર્ગીય દિવસભરની GO સર્વિસ, લાઈટ રેઈલ ટ્રાન્ઝિટ અને બસ રેપિડ ટ્રાન્ઝિટ.
- **આબોહવા પરિવર્તન અને પૂર ઉપશમન** – ભંડોળ અને સુવ્યવસ્થિત મંજૂરીઓ મેળવીને સીટીના રિવરવોક પ્રોજેક્ટ માટે ભાગીદારીમાં વધારો કરવો, અને કમ્યુનિટી એનર્જી એન્ડ એમિશન્સ રિડક્શન પ્લાન (CEERP) મારફતે ઓળખેલા ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર (હરિયાળા માળખાગત) પ્રોજેક્ટ્સમાં નવું રોકાણ કરવું.
- **સક્રિય પરિવહન** – વધારે સારા નભાઉ ચલાયમાનતા વિકલ્પો જે બધાં રહેવાસીઓ માટે પરિવહન નેટવર્ક્સની સુરક્ષા અને પહોંચને સુલભ બનાવવામાં વધારો કરે.
- **સેકન્ડરી પર્યટ તકો** – BramptonU અસ્તિત્વમાં લાવવાનો કાયદો ઘડીને સેકન્ડરી પર્યટ શિક્ષણ તકો વધારવા માટે સહાયતા.
- **જાહેર સંસ્થાકીય મિલકતો માટે મિલકત વેરો-મુક્તિ** – COVID-19 નાં પ્રભાવોને ડામવા અને સંપૂર્ણ અને સફળ આર્થિક રિકવરીની ખાતરી કરાવવા સતત ભંડોળ માટેની વિનંતી.
- **શહેરી સામુદાયિક કેન્દ્ર (અર્બન કમ્યુનિટી હબ)** – બ્રેમ્પટનમાં પરિવહનલક્ષી સમુદાયો (ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ કમ્યુનિટીસ - TOC)ને નિભાવવા માટે નવા વૃદ્ધિ મોડેલ તરીકે શહેરી સામુદાયિક કેન્દ્ર ઊભું કરીને 20 મિનિટ ચાલીને પહોંચી શકાય તેવું, આરોગ્યપ્રદ પાડોશ અપનાવવા પ્રોવિન્સને વિનંતી કરવી.

વધુ માહિતી મેળવવા સીટીની [વેબસાઈટ](#) જુઓ.

### અવતરણો (ક્વૉટ્સ):

“અમે COVID-19 નાં પ્રભાવો સામે આપણી આર્થિક રિકવરીને સહાયરૂપ અને તેવો ગ્રાહકલક્ષી અભિગમ અપનાવવા તરફ કામ કરીએ છીએ ત્યારે, અમે સ્થાનિક ઉકેલો પર પણ ધ્યાન આપી રહ્યાં છીએ જે આપણાં શહેરની ટકાઉ વૃદ્ધિને ચલિત કરશે અને આપણાં રહેવાસીઓ માટે વધારે સારા ગુણવત્તાભર્યા જીવનની ખાતરી કરાવશે. હું પ્રોવિન્સે બ્રેમ્પટન માટે તાજેતરમાં બતાવેલી કટિબદ્ધતાઓ માટે પ્રોવિન્સનો આભાર માનું છું અને આપણે આર્થિક રિકવરી અને વૃદ્ધિના માર્ગ પર આગળ વધીએ ત્યારે આને વધારે પ્રસ્થાપિત કરવા આશાવાદી છું.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“COVID-19 સામે આપણી પ્રતિક્રિયા દરમિયાન, સીટીએ રહેવાસીઓ અવલંબિત હોય તેવી અનિવાર્ય અને નિર્ણાયક સેવાઓ પૂરી પાડવાનું ચાલુ રાખવાની સાથે સાથે આપણી સંપૂર્ણ આર્થિક રિક્વરી અને સતત વૃદ્ધિને સહાયરૂપ થતા મુખ્ય પ્રોજેક્ટ્સ પ્રગતિમય બનાવવાનું પણ ચાલુ રાખ્યું છે. આપણે બ્રેમ્પટનના ભવિષ્ય માટે આયોજન અને નિર્માણ કરી રહ્યાં છીએ ત્યારે સરકારના ઉચ્ચતર સ્તરો સાથે ધનિષ્ઠ સહયોગ આપણી સફળતા માટે નિર્ણાયક બનશે અને હું AMO 2020 દરમિયાન પ્રોવિન્સ સાથે મુખ્ય ભાગીદારીની તકોની ચર્ચા કરવા આશાવાદી છું.”

- ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે [www.brampton.ca](http://www.brampton.ca).

**મિડિયા સંપર્ક :**

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)